

B.Ed. Semester - 3 (CBCS) Examination
DEC/JAN. - 2020 [OLD COURSE]
ELEMENTS OF ACCOUNT(ELECTIVE 1)

Time: 0:45 Hours

Marks: 21

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (૦૫ માંથી ૦૩) (૦૩)
- 1.1. ભાગીદારીની વ્યાખ્યા આપો.
 - 1.2. પાકુ સરવૈયું ખાતું છે?
 - 1.3. કાચું સરવૈયું ખાતું છે?
 - 1.4. જો ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારોને મુડી પર વ્યાજ આપવા અંગે શી જોગવાઈ છે.
 - 1.5. પાઘડીની વ્યાખ્યા આપો.
- પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોનાં જવાબ આપો. (૦૬ માંથી ૦૩) (૦૬)
- 2.1. ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ વિગતો જણાવો.
 - 2.2. ભાગીદારોના મુડી ખાતા રાખવાની પદ્ધતિઓ જણાવો.
 - 2.3. પાઘડીનું મુલ્યાંકન શા માટે કરવું જોઈએ?
 - 2.4. પેઢીના વિસર્જનની રીતો જણાવો.
 - 2.5. ભાગીદાર ક્યારે નિવૃત્ત થઈ શકે?
 - 2.6. ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન વચ્ચે તફાવત આપો.
- પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. (૦૬ માંથી ૦૩) (૧૨)
- 3.1. ભાગીદારીના લક્ષણો જણાવો.
 - 3.2. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ.
 - 3.3. પાકા સરવૈયાનો નમુનો આપો.
 - 3.4. ભાગીદાર પ્રવેશની અસરો જણાવો.
 - 3.5. ભાગીદારીમાં ફેરફારના કારણો જણાવો.
 - 3.6. વેપાર ખાતું નમુના સાથે સમજાવો.
